

# Ahmedabad: Click Diwali pop-up, trigger fraud bomb

AHMEDABAD: A businessman from the Satellite area of the city was Satellite area of the city was browsing through management ideas when a pop-up on his screen presented an attractive mutual funds offering.

He clicked the pop-up, unwittingly giving hackers access to his phone. In eight transactions, evpercrooks

access to his phone. In eight transactions, cybercrooks stole Rs 49,900 from him.

A BBA student from Ahmedabad was watching videos on a website when a pop-up laid out the prospect of meeting beautiful girls in his neighbourhood. He clicked and lost Rs 15,000 to scammers.

The pop-up traps are ensnaring a growing number of people. So the cops and the state cyber cell, which comes ensnaring a growing number of people. So the cops and the state cyber cell, which comes under the CID (crime), have



issued an advisory warning people about the risks of careless clicking. Apart from taking your money, cybercrooks may hack into your device and snoop into

into your device and snoop into your personal life.

The advisory, issued on Saturday by the state cyber cell, said: "Be cautious [about] phishing pop-up advertisements in apps. Do not download any apps with such

pop-ups." The advisory added: "Your personal content or videos can be made viral on social media."

Police said several apps give free passage to the

give free passage to the cyberrooks into people's devices. The pop-up is a common gateway into your devices. Even if a person inadvertently clicks on such pop-ups or links, cyberrooks can swiftly get access to the person's device and obtain crucial information, said a cop from the cyber cell.

Sometimes, the cop said, the cybercrooks also get access to a phone's video camera and record personal activities and spy on the

activities and spy on the target. Thus, the cybercrooks

# **GSFC** University holds its third convocation



Ahmedabad: City-based GSFC University on Sunday organized its third convocation. Chairman of Zydus Cadila Pankaj Patel was the chief guest at the convocation ceremony during which vice-chancellor Dr Nikhil Zaveri presented the university report. University's registrar R B Panchal proposed conferment of degrees to 413 students and gold

medals to eight students which was approved by GSFC University's president P K Taneja, IAS (retired). Taneja said that the university has already implemented several initiatives like novel and emerging programs of study, flexibility in curriculum development, student internship, startup activities for students bridde courses for students, bridge courses and such other valuegenerating initiatives as envisaged in the New Education Policy announced by the Government of India. Patel said that there

by the Government of India.
Patel said that there
can be no greater cause
than educating young minds
and equipping them with the
knowledge, wisdom and
skills to improve and
transform the world. He said
that continuous learning
makes a big difference.
"Learn, even beyond areas
of specialization,
collaborate and work in a
team," Patel said while
urging the graduating
students to be a troubleshooter, an enabler and a
creator while standing by
values. Chairman of Zydus
Cadila Pankaj Patel was the
chief guest at the
convocation ceremony
during which vicechancellor Dr Nikhil Zaveri
presented the university
report.

Nelson Mandela Nobel Peace Award Academy facilitated Ajay Sharma, (M. D.), Moral Group of Companies



Ahmedabad, Nelson Mandela Nobel Peace Award Academy is one of the best Academies in the world whose activities are for Welfare of the Society. The Academy works for Development of the Society and also promotes the people who contribute in developing the Society. In this connection, the Academy recognized Ajay Sharma, Managing Director, Moral Group of Companies for his outstanding contributions in the field of Entrepreneurs development, Creating Employment for all, Government's Atmanirbhar Bharat Mission with Social Responsibilities. 'The Moral Group Of Companies' come a fore rendering its clients some lesson of its lives in Keeping moral and morals and with morale. Having successfully commenced on a low note with economics asits base, the company now in-tunes with Shalby Hospitals comm

more interesting phases of life
reaching out to targetaudience from a platform that's
moving on step-by-step be it
Micro Finance, Real Estate,
Software, Co-operative
Society, Direct Selling, Life
Insurance, Share Trading,
Pharmaceuticals, FMCG,
Organic Agro. Company's
success is totally under
leadership of Ajay Sharma with
is firm Mission Slogan "Moral
Jagana Hai, Bharat Banan Hai"
is to synergize the strengths of
togetherness and create a
common learning without
making any differences be it
Religion or Sex or Castes since
established on 5th December,
2007 and within a short period
of time Moral Group of
Companies presence in more
than 22 states in India having
140 branches and 20 regional
offices and run successfully
thru Moral Foundation Trust offices and run successfully thru Moral Foundation Trust and Moral Industries.

### Shalby Hospitals commences pre-registration for Covid Vaccination for Children



Ahmedabad. Shalby Anmedabad, Shalby Multispecialty Hospitals, one of India's leading multi-specialty hospital chains has begun preregistration for Covid Vaccination for Children. These preregistrations are being conducted at all its 11

Nospitals located across the country, with 4 hospitals in Ahmedabad (SG Highway, Krishna Shalby at Ghuma, Shalby, Marroda, and Vijay, Shalby) and one in each in Mumbai, Jaipur, Indore, Surat, Vapi, and Mohali. Parents can preregister their children using this link https://forms.gle/adwxRTb1 nnLWN7L9 or visit the nearest Shalby Hospital. Shalby Hospital.

Shalby Hospital.
Preregistrations for children are being focused even as talks with schools and other relevant organizations and associations are underway by Shalby to build tie-ups and facilitate mass vaccinations (112.0). vaccinations, (13-9)

# Burglars set ATM kiosk on fire after stealing Rs 31 lakh in Surat



### Brief profile of Dr. Gyanendra Mani, Incoming - CGM, NABARD, Gujarat

Annedada, Dr Gyanendra
Mani has taken over as the new
Chief General Manager & Officer
Incharge, National Bank for
Agriculture & Rural Development
(MABARD), Gujarat
Regional Office. Heis
Ph.D. in Agricultural
Economics from G B
Pant I Inliversity of

NABAKU, GUJJITAT
Rural Development (BIRD),
Lucknow and Head Office in
Mumbal in various capacities.
He has handled several
consultancy projects on behalf
of NABARD. He also
conceived the idea of
and launched the
"THE MICROFINANCE
REVIEW" Journal on

Economics from G
Pant University of Agrik Technology,
P a n t n a g a r,
Utta r a k h a n d.
Despite being a staunch banker by profession, Dr. Mani has made immense contribution to the azademic world with over 100 documents to his credit in form of books/study reports/ Uttarakhand Regional Tesearch papers in Indian and International Journals/ newspapers, etc. He has earlies served NABARD Soddsha, Uttarakhand Regional Offices of NABARD before served NABARDS Oddsha, Uttarakhand Regional Pradesh, Bankers Institute of NaBARD before Grievel NaBARD Soddsha, Uttarakhand Regional Office on 01
Pradesh, Bankers Institute of NaBARD before Grievel NaBARD before Grievel NaBARD Soddsha, Uttarakhand Regional Office on 01
Pradesh, Bankers Institute of November 2021. (19-8)

stealing cash, the burglars forched the machine and the ATM booth. Along with the ATM, fixture, AC and CCTV cameras were destroyed in the fire, police said. Police were informed about the theft at around Sam. The theft is suspected to have been carried out between 12 midnight to 4 am. The ATM was cut open using a gas cutter. There was no security guard employed at the ATM and none in the area came to know about the incident till the personnel of the agency managing the ATM went to check it. Following doubt of suspicious activities, those remotely monitoring the security of the ATM alerted their local official. As the officials went to check hev found the ATM booth alerted their local official. As the officials went to check they found the ATM booth engulfed in fire. Bhupendra Singh, an employee of the firm that maintains ATMs of SBI, lodged the complaint at the Pandesara police station. The ATM was installed in a shop of a commercial complex in Vadod. Cops said that the hurplars sprayed the sprayed that the hurplars sprayed that the hurplars sprayed the sprayed that the hurplars sprayed that the hurplars sprayed the sprayed that the hurplars sprayed that the hurplars sprayed the sprayed that the hurplars sprayed the sprayed that the hurplars sprayed that the hurplars sprayed that the hurplars sprayed the sprayed that the hurplars sprayed the sprayed that the hurplars sprayed the sprayed that the spr complex in Vadod. Cops said that the burglars sprayed paint on the CCTV cameras installed inside the booth before breaking open the ATM. Police suspect that it must have taken over an hour for the burglars to break the CCTV footage of the cameras installed in the area to find out how many persons were involved and the vehicle used by them," said a police officer.

SHRIRAM HOUSING FINANCE LIMITED
HOUSING FINANCE Registered Office: Office No. 129 Aprend William DEMAND NOTICE

Registered Office: Office No.123, Angappa Naicken Street, Chennai-600 00

Head Office: Level 3, Wockhardt Towers, East Wing C-2 Block, Bandra Kurlar

Omplex, Bandra (East), Mumbai 400 051 Website: www.shrimhousing.id

Compiex, Sandra (£485), Mumbai 400 U51. Website: www.shiraminousing.ii in Whereas the borrowers/co-borrowers/coularation/ mentioned hereunder had vailed the financial assistance from SHRIRAM HOUSING FINANCE LIMITED. We state that despite having availed the financial assistance, the borrowers/quarations have committed various defaults in reapwared or interest and principal amounts as per due dates. The account has been classified as Non Performing Asset in accordance with the directives/quidelines issued by Reserve Bank of India, consequent to the Authorized Officer of SHRIRAM HOUSING FINANCE LIMITED under Securitization and Reconstruction of Financial Assets and Enforcement of SHRIRAM HOUSING FINANCE LIMITED under Securitization and Reconstruction of Financial Assets and Enforcement (Base 2002 Issued Demand Notices on respective dates mentioned herite below Section 13(2) of SARFAES Act 2002 Calling upon the following borrowers/quarations/mortgagors to repay the amount mentioned in the inclose sought evil further interest at the contractual rate on the amount mentioned in the inclose sought evil further interest at the contractual rate on the amount emeritanced in the notices and incidental expenses, cost, charges etc until the date of payment within 60 days from the date of receipt of notices.

The notices issued to them on their last known addresses and hereby informed by way of public notice about the same.
The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to Name of the Borrower (S)

Outstanding

Loan No. & Property Address of
Amount

Amount

Secured Assets

Co-Borrower(S)	Amount	Amount	Secured Assets
Co-Borrower(S)  1. Bharat Dhanjibha Dabhi, Address :-  Ned Hon No. 241. Dev-Ashish Nagar Society, R.S. Umiya Ashish Society, Bhestan Road, Morobhagal, Jahanjirhad, Surat-395005  Also Otlice/Business Address Surat Municipal Corporation, Adajan Pumping Station, Parin il Takl, Adajan Road, Surat-395099  2. Ramilaben Bharatbhal Dabhi, Address - Piel No. 241. Dev-Ashish Nagar Society, R.Y. Surat-395099  Also Office/Business Address - Surat Municipal Corporation, Jahanjirhad, Surat-395005  Also Office/Business Address :- Surat Municipal Corporation, Kushan-Kanji Word Office, Opp. BSNL Office, Palanpur Patiya, Surat-395005	Amount Rs. 9,39,802/- (Rupees Nine Lakh Thirty Nine Thousand Eight Hundred Two Only) as on 12/10/2021 under reference of Loan Account No. SLPHSRAT00001 95 with turfer interest as mentioned hitherto and incidental expenses, costs etc	Amourt Loan No. SLPHSRA700 SLPHSRA700 Rs. 10,37,684/-	Secured Assets Sural District Sub District Talluka: Choryasi, Moje, Village: Jahangriada, R. S. No 82.83 A48 55 Block No.176, "A" Type, Plot No.241, admeasuring 58.52 sqmft, Co.PRoad Rasta area. Boundaries of the Property- East-Plot No.4724 West: Plot No.47240 North: Plot No.47261 South: Society Road
NPA DATE - 05-10-2021			
DATE OF DEMAND NOTICE: 23-10-2021			
I. Raval Prakash Hakmichand. 2. Raval Manjulaben Prakashbai Address: Fial No.A.7102, Block No.A., 1st Floor, Akshardham Residency, Opp.R.A.F.Camp S.P.Ring Road, Vastral, Ahmedabad	Rs. 5,42,600/- (Rupees Five Lakh Forty Two Thousand Six Hundred Only) as on 12/10/2021 under reference of Loan Account No.SHLHAHMDD 000188 with further interest as mentioned	Loan No. SHLHAHMD00 00188 & Rs.6,80,698	Property bearing Unit No.102 in Block – A – 1, on the First Floor admeasuring about 06.90 sq.yards in the scheme known as "AKSHARDHAM RESIDENCY" shuated on land of Sub-Plot No.1 of Final Plot No.48 part of Town Planning Scheme No.114 (land of old Revenue Survey No.799/2) situate, lying and being at Mouje: Vastral, Taluka: Ahmedabad (East), in the Registration District of in the Registration District of in the Registration District of in the Registration District of methods.
NPA DATE - 05-10-2021	hitherto and		Ahmedabad and sub district of
DATE OF DEMAND NOTICE: 22-10-2021	incidental expenses, costs etc		Ahmedabad-12(Nikol) Boundaries of the property: East :- after common passage on first floor shop no.1 & 2 West :- wall of Flat No.A/2-103 North :- after margin sub plot West :- wall of Flat No.A/1-101
n the circumstances as aforesaid, the not	tice is hereby given	to the above bor	rowers, co-borrowers and/ or their

guarantors (where ever applicable) to pay the outstanding dues as mentioned above along with future interest and applicable charges within 60 days from the date of the publication of this notice failing which further steps will be taken that the perior of 60 days of the date of this notice against the secured assets including taking possession of the secured assets of the borrowers and the mortgagors under Section 13(4) of Securitization and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act, 2020 and the applicable intest there under.

Passes not that funder Section 1 (3) of the said Act, no Borrower shall, transfer by way of sale, lease or otherwist any of his secured assets referred to in the notice, without prior written consent of the secured creditor. Place: Althredshad & Surat Date: 0.3.11.2.021 Shriram Housing Finance Lite

### GOKUL AGRO RESOURCES LIMITED

CIN- L15142GJ2014PLC080010

Regd. Office: Office No. 801-805, Dwarkesh Business Hub, Survey No. 126/1, Opp. Visamo Society, B/h Atishay Belleview, Motera, Ahmedabad-380005. Statement of Standalone and Consolidated Unaudited Financial Results of the Company for the Second Quarter ended September 30, 2021

Particulars	Standalone Financial Results			Consolidate Financial Results			
	Three months ended on 30.09.2021	Corresponding three months in the previous year ended on 30.09.2020	Year to date figures for current period ended 30.09.2021	Three months ended on 30.09.2021	Corresponding three months in the previous year ended on 30.09.2020	Year to date figures for current period ended on 30.09.2021	
	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	
Total Income from Operations	265,964.67	168,734.32	496,763.84	269,807.48	188,678.93	502,307.76	
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	2,505.61	873.20	4,086.39	2,963.70	1,103.89	4,867.41	
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	2,505.61	873.20	4,086.39	2,963.70	1,103.89	4,867.41	
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	1,803.92	566.60	2,947.27	2,181.94	751.69	3,593.30	
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1,803.92	566.60	2,947.27	2,184.05	651.77	3,648.96	
Equity Share Capital	2,637.90	2,637.90	2,637.90	2,637.90	2,637.90	2,637.90	
Reserves excluding Revaluation Reserves as per Balance Sheet of previous accounting year	26,158.99	20,794.82	26,158.99	31,047.97	24,297.75	31,047.97	
Earnings Per Share (of Rs. 2/- each) (for continuing and discontinued operations)							
a) Basic (Rs.)	1.37	0.43	2.23	1.65	0.57	2.72	
b) Diluted (Rs.)	1.37	0.43	2.23	1.65	0.57	2.72	

Declaring Requirements) Regulations, 2015. The full format of Quarter Handblade and the specific Regulation and Section Requirements (Septiations, 2015). The full format of Quarter Handblade and the specific Regulation R

Related to Standalone Financial Results:

above results have been reviewed by the Audit Committee and thereafter approved and taken on record by the Board of Directors at their Meeting held on 02nd November, 2021 above financial results for the quarter ended on September 30, 2021 has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) scribed under Section 133 of the Companies Act, 2013, and other recognized accounting practices and policies to the verta applicable.

Company is mainly engaged in Agro based Commodities and as such there are no separate Reportable Segment as per Indian Accounting Standard \*Operating Segment\* (Ind AS). Thus, no separate disclosure for Segment Reporting is made.

No Institute of Segment Reporting is made.

Results:

Related to Comsolidated Financial Results:

tess Related to Consolidated Financial Results:

The above results have been reviewed by the Audit Committee and thereafter approved and taken on record by the Board of Directors at their Meeting held on 02nd November, 2021. The above financial results for the quarter ended on September 30, 2021 has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013, and other recognized accounting practices and policies to the extent applicable.

The Company is mainly engaged in Agro based Commodities and as such there are no separate Reportable Segment as per Indian Accounting Standard "Operating Segment" (Ind AS-108). Thus, no separate disclosure for Segment Reporting is made.

Previous year figures have been regrouped or rearranged wherever necessary to meet with the current year's reporting requirements.

Jayesh K. Thakkar Managing Director

# અમદાવાદમાંથી ગુમ થયેલ સી-પ્લેન સર્વિસ ફરી જોવા મળશે...!!!



અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદથી કેવડીયા સી-પ્લેન સર્વિસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણના બીજા દિવસે જયારે મુસાફરો માટે સી-પ્લેન સર્વિસ ખુલ્લી મુકવામાં આવી ત્યારે પહેલા જ સી-પ્લેન કેવડીયાથી અમદાવાદ ૩

કલાક લેટ પહોંચ્યું હતું. આ ઉપરાંત તે વખતે માત્ર ૮ મુસાફરો જ સી-પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તો બીજા જ દિવસે બીજા ફેરા માટે પૂરતા મુસાફરી ન મળતા બીજો ફેરો રદ કરવામાં આવ્યો હતો. જ્યારે આ સર્વિસ શરૂ થઇ તે સમયે આવી. વારેવાર સી-પ્લેનને મેન્ટનન્સ માટે અમદાવાદના દીરવરને સી-પ્લેનમાં સવારની ક્લાઈટનું ભાડું ૧,૫૯૦ રૂપિયા રાખવામાં આવ્યું હતું. જેટલા સમયે પ્લેન મેન્ટેનન્સ બનાવવામાં આવ્યું હતું.

હતું અને બીજી બપોરની ફ્લાઈટનું ભાડું ૨,૨૦૦ રૂપિયા રાખવામાં આવ્યું હતું.૩૧ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ અમદાવાદના સાબરમતી રીવર ફ્રન્ટથી કેવડિયા સુધી સી-પ્લેન સર્વિસની શરૂઆત કરવામાં આવી હતી પણ જાણે આ સર્વિસ દેખાવ માટે શરૂ થઇ હોય તેવું લાગુ રહ્યું છે. કારણ કે, જેટલા જોરશોરથી સી-પ્લેન સર્વિસની શરૂઆત કરવામાં આવી

તેવી જ રીતે ગણતરીના સમયમાં આ સર્વિસ બંધ કરી દેવામાં

દિવાળી પર્વ પહેલા અમદાવાદીઓને

સી-પ્લેન સર્વિસ શરૂ થયા બાદ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે, આ સર્વિસ ૩૬૫ દિવસમાંથી ૨૫૦થી વધુ દિવસ સુધી આ સર્વિસ બંધ રહી હતી. બીજી મહત્ત્વની વાત ખવ રહા હતા. બાજી મહત્ત્વની વાત એ છે કે, ૯ એપ્રિલથી સી-પ્લેનનું એરકાફ્ટ માલ્દિવ્સ પરત મોકલી દેવામાં આવ્યું હતું. ત્યારથી લઇને આજદિન સુધી આ સર્વિસ શરૂ થઇ

એ ઉભા થઇ રહ્યા છે કે , અમદાવાદથી કેવડિયાની સી-પ્લેન સર્વિસ શરૂ થશે કે નહી? જયારથી સી-પ્લેન શરૂઆત થઇ ત્યારથી લઈને એક વર્ષના સમયમાં માત્ર તે ૧૧૦ દિવસ માટે જ ઓપરેટ થયું હતું. આ દરમિયાન ૨૮૪ કલાઈટ અમદાવાદથી કેવડીયા વચ્ચે અવર જવર થઇ હતી. અત્યાર સુધીમાં ૨,૪૫૭ લોકોએ સી-પ્લેનની મુસાફરી કરી છે. આમ ૧૯ મુસફરોની ક્ષમતા ધરાવતા સી-પ્લેનની દરેક ફ્લાઈટમાં સરેરાશ ૯ મુસાફરોએ મુસાફરી કરી. સી-પ્લેન માટે અમદાવાદના રીવરફ્રન્ટ પર એક નદાવાદના રીવરફ્રન્ટપરએક વોટર એરીડ્રોમ પણ

એરક્રાફ્ટ પરત ન આવતા સવાલ

## દિવાળીનાં તહેવારોમાં ડોક્ટર ઓન કોલની સેવા



અમદાવાદ, દિવાળીનાં તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેડિકલ એસોસિએશન (એએમએ) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (એએફપીએ) દ્વારા સતત ૧૨ માં વર્ષે દર્દીઓ માટે તા. ૩ નવેમ્બદર થી તા. ૯ નવેમ્બશર ૨૦૨૧ દરમિયાન ડોક્ટર ઓન કોલની સેવા રજૂ કરવામાં આવી છે. દર્દીઓ માટે આશિર્વાદરૂપ પૂરવાર થયેલી આ સેવામાં બંને એસોસિએશન થયેલી આ સેવામાં બંને એસોસિએશન દ્વારા ઈએમઆરઆઈ ૧૦૮ અને . હોસ્પિટલો સાથે પણ સરળ સંકલન સાધવામાં આવ્યું છે. એએમએ દ્વારા આ ઉપરાંત દિવાળીનાં તહેવારોમાં કાર્યરત

આવ્યું છે અને ડોક્ટરોની યાદી તેમજ એરિયા કો-ઓર્ડિનેટરોનાં નંબરો પણ પૂરા પાડવામાં આવ્યા છે. આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદ મેડિકલ એસોસિએશનનાં પ્રેસિડેન્ટ ડો. દિલીપ ગઢવીએ જણાવ્યું હતું કે, 'દિવાળીનાં તહેવારોમાં મર્યાદિત ડોક્ટરો ઉપલબ્ધ હોવાને તહવારામાં મવાદિત ઇક્ટરા ઉપલબ્ધ હોવાન લીધ દર્દીઓએ ઘણું સહન કરવું પડતું હોય છે. દર્દીઓને અગવડો ના પડે અને સમાજને મદદરૂપ થવાય તેવી ભાવનાથી અમદાવાદ મેડિકલ એસોસિએશન (એએમએ) અને અમદાવાદ ફેમિલી **डि**िश्रीयन એસોસિએશન (એએફપીએ) દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી ડોક્ટર ઓન કોલ દિવાળી સેવાનું

# <sup>હેક્ટરોનું</sup> વોટસ એપ શુપ બનાવવામાં આવેજન કરવામાં આવે છે. '(૨૨-૧) શિક્ષકને સુરેન્દ્રનગરના ગામમાં ઘર ભાડે આપવા કોઈ તૈયાર નથી

આકારે ભેદભાવ સામાન્ય છે પરંતુ શિક્ષકોને પણ આમાંથી બાકાત નથી ...... ત્રુત આનાથા બાકાત નથી રાખવામાં આવતા તે કમનસીબી છે. "મેં વડાપ્રધાન નગેન્ટ મોટી રે.... "મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી છે કે, તેઓ ૨૬ જાન્યું આરી ૨૦૨૨ સુધીમાં એક ગામને ભેદભાવ મુક્ત હોવાનું જાહેર કરે. આવા કિસ્સા ગુજરાતમાં દરેક સ્થળે રોજેરોજ બનતા હોય છે", તેમ દિલિતોના અધિકાર માટે લડતાં કાંતિલાલ પરમારે જણાવ્યું. કાંતિલાલ પરમારે જણાવ્યું. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાની એક સરકારી સ્કૂલમાં ભણાવતા ૫૦ વર્ષીય શિક્ષકને દરરોજ ૧૫૦ કિલોમીટર અંતર કાપીને ઘરેથી સ્કલ ાંકલાનાટર જાતર કાવાન વરવા સ્કૂલ આવવું-જવું પડે છે. જેનું કારણ છે કે, આ શિક્ષક શિડ્યુલ કાસ્ટ (જીઝ) હેઠળ આવતાં વાલ્મિકી સમાજમાંથી આવે છે. જે ગામમાં આ શિક્ષક નોકરી કરે છે ત્યાંની પંચાયતે સત્તાવાર રીતે કહી દીધું છે કે, તેમને અહી ઘર નહી મળે કારણકે ગામમાં વાલ્મિકી સમાજની વસાહત નથી. શિક્ષક સાથે થઈ રહેલા આ દેખીતા અન્યાયને પગલે राज्यना भाभाजिक्ष न्याय अने

સુરેન્દ્રનગર, દલિત અધિકારીતા વિભાગન ગત એક્ટિવિસ્ટના મતાનુસાર, જ્ઞાતિના અઠવાડિયે શિક્ષણ વિભાગને પત્ર ....... ૧ ૦૦૦ ૫ ૫ હતી તેમણે લખવાની ફરજ પડી હતી. તેમણે પત્રમાં લખ્યું, 'શિડ્યુલ કાસ્ટના શિક્ષક ત્રાસ, ભેદભાવ, અસામનતા અને જાતિવાદનો ભોગ બન્યા છે." સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે ત્વરિતપશે આ શિક્ષકની બદલી કરવાની માગ કરી છે. વર્ષીય કનૈયાલાલ બારૈયા સરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છાત્રાળા ગામના રહેવાસી છે. તેમને આ જ જિલ્લામાં આવેલી નિનામા સ્કૂલમાં ટ્રાન્સકર અપાઈ હતી, જે ૭૫ કિમી દૂર આવેલી છે. "હું શાળામાં હાજર થયો પછી મેં ગામમાં ભાડે ઘર શોધવા માટેની કવાયત શરૂ કરી હતી. હં કયા માટના કવાવત શરૂ કરા હતા. હું કવા સમાજમાંથી આવું છું તેવો પ્રશ્ન કરાયો હતો. મેં કહ્યું કે, હું વાલ્મિકી સમાજનો છુંત્યારે મને કહેવામાં આવ્યું કે, વાલ્મિકી યુરાયુર ૧૧૩૭ વા પ્રાવ્યુક, વાલ્કા સમાજના મકાનો અહી નથી માટે તમને ગામમાં ઘર ભાડે નહીં મળે", તેમ કનૈયાલાલે જણાવ્યું. ગામના સરપંચ અને તલાટીએ પણ ગ્રામપંચાયતના લેટરહેડ પર ૧૬ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ કનૈયાલાલને આ વાત લખીને આપી હતી

(Rs. in Lakhs except EPS)

## એકલા મળવા બોલાવી યુવકને માર મારી તોડ કરાયો મહેન્દ્રસિંહ હિના સાથે ઘરમાં બેઠો

ગાંધીનગર, અમદાવાદના જલપુરમાં રહેતા એને ડેરી ચલાવતા મહેન્દ્રસિંહ ગોપાલસિંહ સીસોદિયાની ઈન્સ્ટાગ્રામ દ્વારા એક યુવતી સાથે મિત્રતા થઈ હતી. મિત્રતા થયા બાદ બન્ને વચ્ચેનું અંદરઘટતા એક બીજાનો નંબર શેર કર્યો હતો. આ પછી ઈન્સ્ટાગ્રામ દ્વારા ઓળખ થયેલી હિનાએ મહેન્દ્રસિંહને વાવોલમાં મળવા માટે બોલાવ્યો હતો. હિનાએ મહેન્દ્રસિહને ગાંધીનગરમાં આવેલા વાવોલના સ્વર્ણિમ પેરેડાઈઝ સોસાયટીમાં મળવા માટે બોલાવ્યો હતો .૨૮મી તારીખે ઘરમાં ઘૂસી આવેલા શખ્સોએ મહેન્દ્રસિંહને કોર્ટમાં લઈ જવાના બહાને ૨૮મી લઇ જવાના ખહાન ૨૮મા ઓક્ટોબરે ઘરમાંથી બહાર કાઢ્યો ત્યારે તક મળતા મહેન્દ્રસિંહ ત્યાંથી ભાગી ગયો હતો. ભાગવામાં સફળ થયેલો મહેન્દ્રસિંહ પોતાના ઘરે પહોંચી ગયો હતો અને પોતાની સાથે બનેલી ઘટના વિશે પરિવારને જાણ કરી હતી. આ પછી પોતાની સાથે ગત હતા. બનેલી ઘટના અંગે મહેન્દ્રસિંહે હિના અને વિક્રમસિંહ નામના વ્યક્તિ સામે કરિયાદ નોંધાવી છે. આ કેસમાં એવી પણ વિગતો સામે આવી રહી છે કે, મહેન્દ્રસિંહને ડરાવનારો વિક્રમસિંહ નામનો વ્યક્તિ પોતે પોલીસમાં ગામના વ્યાક્ત પાત પાલાસમા હોવાનું પણ કહેતો હતો. આ સમગ્ર ઘટના અંગે મહેન્દ્રસિંહે સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. હવે આ હિના અને વિક્રમસિંહની ટોળકી લોકોને ફસાવવા માટે આ પ્રકારના કાવગા કરતા હતા કે ખરેખર ત્રકારના કાવના કલા ક ગર વર વિક્રમસિંહ અને હિના ભાઈ બહેન હતા તે પોલીસ તપાસમાં જાણવા

માટે તજવીજ હાથ ધરી છે. સોશિયલ મીડિયા દારા પ્રેમ પ્રકરણ અને છેતરપિંડીના કેસમાં સતત વપારો થઈ રહ્યો છે. આવી જ વધુ એક ઘટના ગાંધીનગરના વાવોલમાં બની છે કે જ્યાં યુવતીને પ્રેમ પ્રકરસમાં એક લી મળવા બોલાવીને છેતરપિંડી આચરવામાં આવી છે. યુવતીએ એકલામાં મળવા બોલાવી હોતાનું જ્યાની મહેનસિંહ રપ ઓ ક્ટોબરના રોજ હિનાને મળવા માટે પહોંચી ગયો હતો. આ પહેલા પણ બોલા બેલા ને માર્ગ પહોંચી ગયો હતો. આ પહેલા પણ બેલા મળ્યા હોનાનું સામે પહેલા પણ બન્ને મળ્યા હોવાનું સામે આવી રહ્યું છે. પરંતુ ૨૫મી ઓક્ટોબરે યુવક એકલી રહેતી હિનાને મળવા ગયો ત્યાર બાદ બન્ને ઘરમાં એકલા બેઠા હતા. છોકરીએ

હતા ત્યાર બહારથા કાઇએ દરવાજી ખખડાવ્યો હતો. આ પછી હિનાએ મહેન્દ્રસિંહને કહ્યું કે ઘરમાં કથાંક છૂપાઈ જાય હું જોઉ છું. આ પછી કમમાં ઘૂસેલા વ્યક્તિઓએ મહેન્દ્રસિંહને શોધીને કહ્યું કે તું અહી. શું કરો રહ્યો છું અને પછી પછી માર પારવાનું શરુ કહ્યું હતું. આ બે શખ્સોએ મહેન્દ્રસિંહને શોધીને કહ્યું હતું. આ બે શખ્સોએ મહેન્દ્રસિંહને માર માર્યા બાદ તેની પાસેથી મોબાઈલ ફોન અને ત્રણ હજાર રૂપિયા રોકડા છીનવી લીધા હતા. ઘરમાં આવી ગયેલા હતો, અમે તારા પર કેસ કરીશું. અને જો ફરિયાદ ના થવા દેવી હોય તો પાંચલાખ રૂપિયા આપી દે. છોકરીને એકલતામાં આ બધા સપના જોઈને એકલામાં મળવા પહોંચેલા મહેન્દ્રસિંહને મોડો ખ્યાલ આવ્યો કે પહોંચેલા મહેન્દ્રસિંહને ખબર નહોતી કે હિના મોટો દાવરમી જશે. પોતે ભરાઈ ગયો છે.

# દિવાળીના દિવસોમાં ગુલાબી ઠંડીથી વધુ ચમકારો અનુભવાશે

અમદાવાદ, હવામાન ખાતાની દિવસોમાં ગુલાબી ઠંડીથી વધુ કહી આગાહી મુજબ હાલમાં ઉત્તર-પૂર્વીય શકાય તેવા ચમકારો અનુભવાશે તે પવનના કારણે ઠંડીનું પ્રમાણ ધીમે નિશ્ચિત છે. રાત્રિના નોકરી પુરીને ધીમે વધી રહ્યું છે. દિવસે મહત્તમ ઘરે જતા હોય તેવા કર્મચારીઓ તાપમાન ધીમે ધીમે ઘટી રહ્યું છે અને રાત્રિના ઠંડી વધી રહી છે. અંધારું ઢળતા જ ઠંડીનો માહોલ શરૃ થઈ જાય છે જેમ જેમ રાત આગળ ધંપતી જાય છે તેમ તેમ ઠંડીનો પ્રભાવ વધતો જ જાય છે. લઘુત્તમ તાપમાન ૨૧ ડિગ્રી આસપાસ રહેતું હતું તે ઘટીને ૧૫ ડિગ્રીએ પહોંચવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. દિવાળીના

ઠંડીનો વિશેષ અનુભવ કરી રહ્યાં છે. હવે કબાટમાં ઘડી કરીને સાચવી રાખેલા ગરમ કપડાં બહાર નીકળી રહ્યાં છે. ટેક સમયમાં શહેરીજનો દેરીથી જોવા મળશે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી ચાર થી પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહી.

## મળશે પોલીએ આરોપીઓને શોધવા SHRIR MM DEMAND NOTICE

# શ્રીરામ હાઉસિંગ ફાયાનાન્સ લીમીટેડ

NOUSING FINANCE

REAL SAMBR : ઓક્રિય ના ૧૨૩, બન્યપાનીકન સ્ટ્રીટ, વેલાઇ-૨૦૦૦૦૧ કે ઓફ્રિય નો ૧૨૩, બન્યપાનીકન સ્ટ્રીટ, વેલાઇ-૨૦૦૦૦૧ કે ઓફ્રિય લેલા ૩, લોકાઇટ વર્લા, ઇસ્ટ રિખ્યાની-૨ લ્લોક, લાંઘ ફુલાં કોમ્પ્રેલ, બાંદ કોમ્ કરવાર ક્ષારાન હાડાસર કાયવાન્યતા આધુત આધકાત્વા હાકપારા દાઝાગન ભવા દરક્ષાને હાય કાયવાનાત્વા અધિકાત કર્યા એક કેસ્ એન્કોસીન્ટ એક ક્ષ્મોરી ટીઇ ન્ટર્સ્ક એક્ટ ૨૦૦૨ (જાવોલ કાયડા) મિત્રા, ૨૦૦૨ (જાકાંક વિમ્યો)ના મિત્રમ કર્યા કે વંચાતી કલમ૧૩(૨) હેઠળ મળેલી સત્તાની ફએ નીચે કોષ્ટકમાં જ્લાવેલ દેવાદારોને જ્લાવેલ માંગલા નોટીસોમાં જ્લાવેલ ૨૪મ પરત યુક્વવા માંગલા નોટીસો જાદી કરી હતી. તેમને સીક્યુઇઇઝાન એન્ટ રીકન્યદ્રકાન ઓફ કાઇનાન્સ એસ્ટ એન્ડ એન્કોસીન્ટ આફે અ સિક્યુરી ઇન્ટર્સ્ક એક્ટ ૨૦૦૨ (સર્ચ્ક્રીની એક્ટ)ઢેઠળ લેવારો/જાનીનદારો માર્ગ્ટરોમ આદિવાનો અંદર યુકવી દેવી. આ જાહેર નોટિસ વિકળતી ૨૬મ આકસ્મિક ખર્ચ, કોસ્ટ, ચાર્જિલ વગેરેની સાથે નોટીસ પ્રસિષ્ય થયાના ૧૦ દિવસની અંદર યુકવી દેવી. આ જાહેર નોટિસ છેલ્લા જાણ મજબના સરનામાં પર મોકલવામાં આવી હતી તે સ્વીકાર્યા વગરની પાછી કરી છે તેથી આ નોટીસ મોકલાવવામાં આવી છે . કરજદારો ધ્યાન આપો કે સેક્શન ૧૩ એક્ટના સબ - સેક્શન (૮)ની જોગવાઈ મુજબના સમયમાં આ આરક્ષિત મિલકત છોડાર્વ

જદારો (રો)/ બાકી નિકળતી લોન નં. અને લોન આરક્ષિત મિલકતનં

1. ભરત પનજીભાઈ ડાબી, સરનામું :- (રિપાન વાર્ષ મોતાવારી, બોરન વાર્ષ મોતાવારી, બોરન વાર્ષ મોતાવારી, બોરન વાર્ષ, મોતાવાર, માતાવાર, માતાવાર, માતાવાર, મોતાવાર, માતાવાર, માતાવાર, માતાવાર, માતાવાર, માતાવાર, માતાવાર, મ	કરજદારા(રા)/ સહ- કરજદારો(રો)નું નામ	રકમ	રકમ	આરાગત (મલકતા) સરનામું
માંગણા નોટિસની નારીખ : ૨૩.૧૦.૨૦૨૧  1. રાવલ પ્રકાશ ધાર્મિયન્દ .	પહેરાનું ર. અશિય નગર સોસાઘટી, બીએસ તે . રગ, દેવ આશિય નગર સોસાઘટી, બીએસ ઉપિયા આશિય સોસાઘટી, બોસ્ટન રોડ, મોરાભાગલ, જહાંગીરબાદ, સુરત- ૩૯૮૫૦૫. બન્યા આદિસ્મિળિઝનેસ સરનામું - સુરત મુન્સિપથ કોપોરેશન, અદ્યાજ્ય પેપીગ સ્ટેશન, પાશીની ટાંકી, આદાજ્ય દોડ, સુરત-૩૯૮૫૦૦૯. ૨. રમીલાખેન ભરતભાઈ ડાળી, સરનામું : પ્લોટ નં. ૨૨૧, દેવ. આશિય નગર સોસાઘટી, બોસ્ટન દોડ, મારાભાગલ, જહાંગીરબાદ, સુરત-૩૯૮૫૦૦૫.  અન્ય ઓક્સિબિઝનેસ સરનામું - સુરત-૩૯૫૦માં સ્ટાન્સિપલ કોપોરેશન, ક્યાન્ડ કુંગ લાંડે અંકિસ, બીએસએનએલ ઓકિસ સામ, કુંગ લાંડે ઓક્સિ, બીએસએનએલ ઓકિસ સામ, પાલનપુર્વે	(રૂપિયા નવ લાખ ઓગલમાલીસ હજાર આઠ સો બે પુરા) જે ૧૨/૧૦/૨૦૨૧ના રેક્રેન્સ હેઠળ લોન 95 ઉપરોક્ત નિર્ધારિત વ્યાજ દર, અને અન્ય અર્ચ, જરી કોસ્ટ	SLPHSRAT000 0195 અને	મીજું ગામ- જાહોંગીરબાદ, આરએસ. નં. ૮૨,૮૩,૮૪,૮૫ બ્લોક નં. ૧૭૬, એ ટાઈપ, પ્લોટ નં. ૨૪૧, માપ ૫૮.૫૨ સ્કેવર મી. સી.ઓ.જી રોડ રાસ્તા એરિયા. તેની ચારે બાજુ :- પુર્વે :- પ્લોટ નં. એ/૨૪૨ પશ્ચિમ- પ્લોટ નં. એ/૨૪૧ ઉત્તરે :- પ્લોટ નં. એ/૨૬૧
ા. રાવલ પ્રકાશ હાલીમવન્દ ૨. રાવલ મંજુલાબેન પ્રકાલમાઈ ** સરાનમું : * કહેટ તે. એ '1/102, લ્લો ક તે. એ, વલો માળ, આવરપામ રેલોદીનો, આત્ર.સં.એક. કે. એમ. એસ.પી. દીંગ રોડ, વસાલ, અમદારાદ. ** કેમ્પ્ર હોંગ્યન પૂર્વ રે/10/202 રના રેસ્ત્ર કેલ લેલ લેલ કેમ્પ્ર કેમ્પ્ર કેમ્પ્ય કેમ્પ્ર કેમ્પ્ય કેમ્પ્ર કેમ્પ્ર કેમ્પ્ર કેમ્પ્ય કેમ્પ્ર કેમ્પ્ર કેમ્પ્ર કેમ્પ્ય કેમ્પ્ય કેમ્પ્ય કેમ્પ્ર કેમ્પ્ય કેમ્પ્ર કેમ્પ્ય	એનપીએ તારીખ- ૦૫.૧૦.૨૦૨૧			
ર. ગ્રવલ મંજુલાનેન પ્રકારભાઈ સંવાધ મં એ-1/102, લ્લોક નં એ, ૧લો માળ, આવરપામ રેલી? વી, ત્યાર એ સ્કે. કેમ, એસ.પી. દીંગ રો, વસાલ, અંમદાલદ. કેમન હેળ લોન કેમન હેળ લોન કર્માં માં ૧૪ (લેન્ડ ઓક સાંધ સાથે કુદ , તે અન્ય ખર્ચ, પૂર્વ કેસ્ટ સાથે સુક્લી રેલી. એનપીએ તારીખ ૦૫.૧૦.૨૦૨૧ માંગલા નોટિસની નારીખ : ૨૨.૧૦.૨૦૨૧	માંગણા નોટિસની તારીખ : ૨૩.૧૦.૨૦૨૧			
	ર. રાવલ મંજુલાંબે પ્રકાશભાઈ કરનામું : કલેટ તે એ-૧/૧૦૨, લ્લોક નં એ, ૧લો માળ, અશરધામ રેસીરિની, આર.એ એક. કેમ્પ, એસ.પી. રીંગ રોઠ, વસાલ, અમદાવાદ એનપીએ તારીખ- ૦૫.૧૦.૨૦૨૧	ંરૂપિયા પાંચ લાખ બેતાલીસ હજાર છ સો પુરા) જે ૧૨/૧૦/૨૦૨૧ના રેફ્રેન્સ હેઠળ લોખ ઝેકાઉન્ટ નં. SHLHAHMD0 000188 ઉપરોક્ત નિર્ધારિત વ્યાજ દર, અને અન્ય અર્ચ, જરૂરી કોસ્ટ	SHLHAHMD0 000188 અને	એ-૧ના કર્સ્ટ કહોર પર માપ લગભગ ૮-૮૦૦ કોલ્ડ પાર્ટીમાં ઓળખાય છે. આસ્ત્રામાં રેસી ને બી જે લખ- હોટ નં. ૧ ઓક કામનલ હોલ કે તેટ પાર્ટ એક દાવત હોલ કે તેટ પાર્ટ એક અલ્લાદ (ઇસ્ટ) માં બંન લાખે લાખે લાખે લાખે લાખે લાખે લાખે લાખે

પરોક્ત કરજદારોને આથી નોટીસ આપવામાં આવે છે કે આ નોટીસ પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસની અંદર બાકી નિકળતી રકમ ચુકવી દેવી જો ાખવાના રુજારતાને આથા નાટાસ આપવામાં આવે છે કેવા નોટીસ પ્રેસિલ્થ થયાના 60 ફિસ્સની એક્ટર બાદી નિયંભી રાખ્યું કરી હીં જો આ 60 ફિસ્સની મુદ્દ પૂર્વ કેવા જેવા નાટ્યાં મેં દરમ કુવાવામાં માના જાયાં તો આપણી મહેવાડી બીટો કુંદ્રો લઈ કરે કરો સો સો પાય પર્વ એને લેવાડી થયો કરે હિલ્દ કેવા કેવા સે માના પર્વ એને લેવાડી થયો કરે કેવાડી કરો છે. તે કેવાડે કેવાડ કેવાડ

સહી/- અધિકત અધિકારી સ્થળ : અમદાવાદ અને સુરત તારીખ : ૦૩.૧૧.૨૦૨૧ શ્રી રામ હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ

## નવા બ્રિજની ભેટ ટ્રાફિક માંથી મુક્તિ મળશે. ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૧૪૭ ના ૪૪ ઓવરબ્રિજથી ગોતા સુધીના અઢી કિલોમીટરના એલિવેટેડ કિલો મીટરના એલિવેટેડ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થઇ ગયું છે.

ગાંધીનગર-સરખેજની મુસાફરી એકદમ સરળ બનશે. અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ અને જંકશનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે. અગાઉ થલતેજ અંડરપાસથી સોલા ઓવરબ્રિજ સુધીના ૫૧ કારોડના ખર્ચે બનેલો ૧.૫ કિલોમીટરનો બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારે હવે સોલા ઓવરબ્રિજથી ગોતા સુધીના ૨.૫ કિલોમીટરના બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. બ્રિજના લોકાર્પણ માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. આ બ્રિજનં લોકાર્પણ થતા હવે વાહનચાલકોને કારગીલ ચાર રસ્તા

કીમી લાંબા રસ્તાની બંને બાજુ સર્વિસ રોડ સાથેના છ-માર્ગીકરણની કામગીરી ૯૧૩ કરોડના ખર્ચે પૂર્ણ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. જે અંતર્ગત ૧૩ ફ્લાયઓવરમાંથી ૭ ફ્લાય ઓવર કાર્યરત થઇ ચુકથા છે અને આઠમાં ફ્લાયઓવરનું આજે લોકાર્પણ થયું છે અને બાકીના ૫ ફ્લાય ઓવર નિર્માણાધિન છેબ્રિજને ખલ્લો મકાયા બાદ વાહન ચાલકોને સરખેજથી ખોડિયારનગર સુધી જવું સરળ બની રહેશે .દિવાળી પર્વ પહેલા રહેશ.ાદવાળા ૧૧ ૧૯ના અમદાવાદીઓને નવા બ્રિજની ભેટ મળવા જઈ રહી છે. જી હા સોલા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે તથા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી તેમજ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર કિરીટ પરમાર,અમદાવાદ શહેર અને ગાંધીનગરના ધારાસભ્યો, તેમજ અન્ય નેતા, અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તો ચાલો આજે તમને આ બ્રિજની વિશેષતા અને અન્ય માહિતી જણાવી

## **GOKUL AGRO RESOURCES LIMITED**

CIN- L15142GJ2014PLC080010

Regd. Office: Office No. 801-805, Dwarkesh Business Hub, Survey No. 126/1, Opp. Visamo Society, B/h Atishay Belleview, Motera, Ahmedabad-380005. Statement of Standalone and Consolidated Unaudited Financial Results of the Company for the Second Quarter ended September 30,

Particulars	Standa	alone Financial R	esults	Consolidate Financial Results			
	Three months ended on 30.09.2021	Corresponding three months in the previous year ended on 30.09.2020	Year to date figures for current period ended 30.09.2021	Three months ended on 30.09.2021	Corresponding three months in the previous year ended on 30.09.2020	Year to date figures fo current period ended or 30.09.2021	
	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	
Total Income from Operations	265,964.67	168,734.32	496,763.84	269,807.48	188,678.93	502,307.76	
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	2,505.61	873.20	4,086.39	2,963.70	1,103.89	4,867.41	
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	2,505.61	873.20	4,086.39	2,963.70	1,103.89	4,867.41	
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	1,803.92	566.60	2,947.27	2,181.94	751.69	3,593.30	
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1,803.92	566.60	2,947.27	2,184.05	651.77	3,648.90	
Equity Share Capital	2,637.90	2,637.90	2,637.90	2,637.90	2,637.90	2,637.90	
Reserves excluding Revaluation Reserves as per Balance Sheet of previous accounting year	26,158.99	20,794.82	26,158.99	31,047.97	24,297.75	31,047.9	
Earnings Per Share (of Rs. 2/- each) (for continuing and discontinued operations)							
a) Basic (Rs.)	1.37	0.43	2.23	1.65	0.57	2.72	
b) Diluted (Rs.)	1.37	0.43	2.23	1.65	0.57	2.72	

ated to Standalone Financial Results

ptes Related to Standalone Financial Results:

The above results have been reviewed by the Audit Committee and thereafter approved and taken on record by the Board of Directors at their Meeting held on 02nd November, 2021. The above financial results for the quarter ended on September 30, 2021 has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013, and other recognized accounting practices and policies to the extent applicable.

The Company is mainly engaged in Agn based Commodities and as such there are no separate Reportable Segment as per Indian Accounting Standard "Operating Segment" (Ind AS 108). Thus, no separate disclosure for Segment Reporting is made.

108). Thus, no separate disclosure for Segment Reporting is made.

109. Thus, no separate disclosure for Segment Reporting is made.

109. Thus, no separate disclosure for Segment Reporting is made.

109. Thus, no separate disclosure for Segment Reporting is made.

109. Thus, no separate disclosure for Segment Reporting is made.

109. Thus, no separate disclosure for Segment Reporting is made.

109. Thus, no separate disclosure for Segment Reporting is made.

109. Thus, no separate disclosure for Segment Reporting is made.

109. Thus, no sequence are included in the current year's reporting requirements.

ptes Related to Consolidated Financial Results:

The above results have been reviewed by the Audit Committee and thereafter approved and taken on record by the Board of Directors at their Meeting held on 02nd November, 2021. The above financial results for the quarter ended on September 30, 2021 has been prepared in accordance with the Companies (Indian Accounting Standards's) Rules, 2015 (Ind AS). The above financial results for the quarter ended on September 30, 2021 has been prepared in accordance with the Companies (Indian Accounting Standards's) Rules, 2015 (Ind AS). The Company is manify engaged in Agos based Commodities and as such there are non-separate Reportable Segment as per Indian Accounting Standard \*Operating Segment\* (Ind AS 108). Thus, no separate disclosure for Segment Reportable Se

te: 02.11.2021 Jayesh K. Thakka